

**JB-101**  
**January-2016**  
**M.Com., Sem.-I**  
**405 : Financial Markets**

**Time : 3 Hours]****[Max. Marks : 70**

- સૂચના :**
- (1) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
  - (2) જમણી બાજુ દર્શાવેલ અંક દરેક પ્રશ્નના ગુણ સૂચવે છે.

1. (A) નાણાકીય સંહિતા (સિસ્ટમ) એટલે શું ? નાણાકીય સંહિતા (સિસ્ટમ)ની ભૂમિકા સમજાવો. 7

**અથવા**

બજાર આધારિત નાણાકીય સંહિતા એટલે શું ? બજાર આધારિત નાણાકીય સંહિતાનાં લાભો જરૂરાવો.

- (B) તફાવત જણાવો : (ગમે તે બે)
- (i) બેંક-આધારિત અને બજાર આધારિત નાણાકીય સંહિતા
  - (ii) નાણાં બજાર અને મૂડી બજાર
  - (iii) વૈધિક (ઔપચારિક) નાણાકીય ક્ષેત્ર અને અવૈધિક (અનૌપચારિક) નાણાકીય ક્ષેત્ર
- (C) એક-બે લીટીમાં જવાબ લખો :
- (i) પ્રાથમિક બજાર એટલે શું ?
  - (ii) ગૌણ બજાર એટલે શું ?
  - (iii) મૂડી બજારનાં બે અંગો જણાવો.

2. (A) મૂડી બજારમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા સમજાવો. 7

**અથવા**

કોમર્શિયલ પેપર બહાર પાડવાની પ્રક્રિયા (પદ્ધતિ) સમજાવો.

- (B) તફાવત જણાવો : (ગમે તે બે)
- (i) કોલ મની (મૂડી) બજાર અને ગીરવી કરાર લોણાં અને ધીરધાર શરતો (CBLO).
  - (ii) કોમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ ઓફ ડિપોजીટ
  - (iii) દેશની વેપારી હુંડી અને પરદેશી વેપારી હુંડી

(C) એક-બે લીટીમાં જવાબ લખો :	3
(i) ટ્રેડરી બિલ કોડ બહાર પાડે છે ?	
(ii) ટ્રેડરી બિલનાં પ્રકારો જણાવો.	
(iii) મૂડી બજારનાં લક્ષણો જણાવો.	
3. (A) સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની મૂડી બજારમાં ભૂમિકા સમજાવો. 7	
<b>અથવા</b>	
મૂડી બજારનાં કાર્યો સમજાવો.	
(B) તફાવત જણાવો : (ગમે તે બે) 4	
(i) શરૂઆતનું જાહેર ભરણું (IPO) અને પછીના કમનું જાહેર ભરણું (FPO)	
(ii) જાહેર ભરણું અને રાઈટ્સ ભરણું	
(iii) જાહેર ભરણું અને પ્રાઇવેટ પ્લેસમેન્ટ (ખાનગી ભરણું)	
(C) ટૂકમાં જવાબ લખો : 3	
(i) મૂડી બજારના મધ્યરથીઓ જણાવો.	
(ii) ECBનું આખું (સંપૂર્ણ) સ્વરૂપ જણાવો.	
(iii) FCCBનું આખું (સ્વરૂપ) જણાવો.	
4. (A) ગૌણા (સેકન્ડરી) બજારનાં કાર્યો સમજાવો. 7	
<b>અથવા</b>	
સ્ટોક માર્કેટ ઇન્ડેક્સનું મહત્વ સમજાવો.	
(B) ટૂકમાં જવાબ લખો : (ગમે તે બે) 4	
(i) રોલીંગ સેટલમેન્ટ એટલે શું ?	
(ii) સર્કિટ બ્રેકર એટલે શું ?	
(iii) ડીમેટ ઓફ સિક્યુરિટીઝ એટલે શું ?	
(C) એક-બે લીટીમાં જવાબ લખો : 3	
(i) ભારતના સૌથી જૂના શેરબજારનું નામ આપો.	
(ii) OTCEIનું સંપૂર્ણ સ્વરૂપ જણાવો.	
(iii) S&P CNX Niftyમાં કેટલા શેરોનો સમાવેશ થાય છે ?	

5. સાચા જવાબની પસંદગી કરો :

14

- (1) નીચેના જણાવેલ વિકલ્પોમાંથી, \_\_\_\_\_ નાણાં બજારનું સાધન નથી.
- (a) સર્ટિફિકેટ ઓફ ડિપોર્ઝિટ (b) ટ્રેડરી બિલ  
(c) પ્રેફરેન્સ શેર (d) કોમર્શિયલ પેપર
- (2) \_\_\_\_\_ ને શાખનાં સર્જકો પણ કહેવામાં આવે છે.
- (a) બેંકિંગ સંસ્થાઓ (b) વિકાસ નાણાકીય સંસ્થાઓ  
(c) ગૃહ નાણાં સંસ્થાઓ (d) ઉપરમાંના કોઈપણ વિકલ્પ નહીં
- (3) મજબૂત નાણાકીય સિસ્ટમનું \_\_\_\_\_ સૌથી મૂળભૂત અંગ છે.
- (a) શેર બજાર (b) મૂડી બજાર  
(c) જાહેર નાણાં નીતિ (d) સ્વસ્થ કાયદાકીય વ્યવસ્થા
- (4) નીચેના સાધનોમાંથી \_\_\_\_\_ માં વખતસર નાણાં ચૂકવણીનું જોખમ નથી.
- (a) ટ્રેડરી બિલ (b) કોમર્શિયલ પેપર  
(c) સર્ટિફિકેટ ઓફ ડિપોર્ઝિટ (d) કોમર્શિયલ બિલ
- (5) સર્ટિફિકેટ ઓફ ડિપોર્ઝિટમાં લઘુતમ પાકતી મુદ્દત ઓછામાં ઓછી \_\_\_\_\_ દિવસ છે.
- (a) 91 (b) 60  
(c) 15 (d) 7
- (6) ટર્મ મૂડી બજારમાં લઘુતમ પાકતી મુદ્દત \_\_\_\_\_ છે.
- (a) 15 દિવસ (b) 30 દિવસ  
(c) 1 વર્ષ (d) 3 મહિના
- (7) SEBIને વૈધાનિક સત્તા \_\_\_\_\_ માં આપવામાં આવી.
- (a) ઑગસ્ટ 1992 (b) ડિસેમ્બર 1992  
(c) જાન્યુઆરી 1992 (d) માર્ચ 1992
- (8) રેડ હેરીંગ પ્રોસ્પેક્ટસમાં \_\_\_\_\_ ની માહિતી નથી.
- (a) શેરની કિંમત (b) કુલ ઈશ્યુના કંડ  
(c) મર્યાદા બેંકરના નામ (d) ઈશ્યુ ખુલવાની તારીખ

- (9) ગ્રીન શુ વિકલ્પનું ઉપયોગ કરવા માટે, કંપનીએ \_\_\_\_\_ ને નિમણૂક કરવા પડે.

  - અન્ડરરાઇટર (વીમાકર્તા)
  - અદા અને ભરવા એજન્ટ (ઈશ્યુ અને પેર્સિંગ એજન્ટ)
  - શેર દલાલ
  - સ્થિર કરનાર એજન્ટ (સ્ટેબિલાઇઝિંગ એજન્ટ)

(10) ઈશ્યુને સફળ કરવા માટે, એક કંપનીને ઓછામાં ઓછા \_\_\_\_\_ ભાવિ ફાળવણી મેળવનારોની જરૂર છે.

  - 500
  - 600
  - 1000
  - 100

(11) \_\_\_\_\_ ઑર્ડરને રોકાણકારની કિમત સ્પષ્ટતાના આધારે અમલમાં મૂકવામાં આવે છે.

  - લિમિટ
  - સ્ટેન્ડીંગ
  - માર્ક્ટ
  - ઉપરમાંનું કોઈ વિકલ્પ નહીં

(12) \_\_\_\_\_ બજાર નાની અને મધ્યમ કદની કંપનીઓને મૂડી બજારમાંથી નાણાં ભંડોળ ઊભું કરવામાં સાનુક્ષળતા આપે છે.

  - BSE
  - NSE
  - OTCEI
  - ASE

(13) કોલ નાણાં (મની) બજારમાં ઉછીના નાણાં પર જે વ્યાજ લેવામાં આવે છે તેને \_\_\_\_\_ કહેવાય છે.

  - કોલ વ્યાજ
  - કોલ દર
  - કોલ સરખસ
  - ઉપરમાંનું કોઈ વિકલ્પ નહીં

(14) જો ઈશ્યુ 100% બુક-બિલ્ડ હોય, તો વ્યક્તિગત રીટેલ (નાના) રોકાણકારો માટે ઓછામાં ઓછી \_\_\_\_\_ ની ફાળવણી કરવામાં આવે છે.

  - 25%
  - 45%
  - 35%
  - 55%

**Seat No. :** \_\_\_\_\_

**JB-101**  
**January-2016**  
**M.Com., Sem.-I**  
**405 : Financial Markets**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70]**

**Instructions :** (1) All questions are compulsory.

(2) Figures to the right indicate marks allotted to each question.

1. (A) What is Financial System ? Explain the role of Financial System. 7

**OR**

What is market-based financial system ? State the advantages of market-based financial system.

(B) Distinguish between : (Any **two**) 4

(i) Bank-based and Market-based Financial Systems

(ii) Money Market and Capital Market

(iii) Formal Financial Sector and Informal Financial Sector

(C) Answer in **one-two** lines only : 3

(i) What is Primary Market ?

(ii) What is Secondary Market ?

(iii) State the two components of Capital Market.

2. (A) Explain the role of the Reserve Bank of India in Money Market. 7

**OR**

Explain the procedure for issuing Commercial paper.

(B) Distinguish between : (Any **two**) 4

(i) Call Money Market and Collateralised Borrowing and Lending Obligation (CBLO).

(ii) Commercial Paper and Certificate of Deposit.

(iii) Inland Commercial Bill and Foreign Commercial Bill.

- (C) Answer in **one-two** lines : 3
- (i) Who issues Treasury Bills ?
  - (ii) State the types of Treasury Bills.
  - (iii) State the characteristics of Money Market.
3. (A) Explain the role of Securities and Exchange Board of India in the Capital Market. 7
- OR**
- Explain the functions of Capital Market.
- (B) Distinguish between : (Any **two**) 4
- (i) Initial Public Offer (IPO) and Follow-on Public Offer (FPO)
  - (ii) Public Issue and Rights Issue
  - (iii) Public Issue and Private Placement
- (C) Answer in brief : 3
- (i) Name the intermediaries of the Capital Market.
  - (ii) Give the full form of ECB.
  - (iii) Give the full form of FCCB.
4. (A) Explain the functions of Secondary Market. 7
- OR**
- Explain the importance of Stock Market Index.
- (B) Answer briefly : (Any **two**) 4
- (i) What is Rolling Settlement ?
  - (ii) What is Circuit Breaker ?
  - (iii) What is dematerialization of securities ?
- (C) Answer in **one-two** lines : 3
- (i) Which is the oldest stock exchange of India ?
  - (ii) Give the full form of OTCEI.
  - (iii) How many scrips are included in S&P CNX Nifty ?

5. Select the correct answer :

14

- (1) From the options below, which one is not a money market instrument ?  
(a) Certificate of Deposit      (b) Treasury Bill  
(c) Preference Share      (d) Commercial Paper
- (2) \_\_\_\_\_ are also known as creators of credit.  
(a) Banking Institutions      (b) Development Financial Institutions  
(c) Housing Finance Companies (d) None of the above
- (3) Which is the most fundamental element of a strong financial system ?  
(a) Stock Exchanges      (b) Money Market  
(c) Public Finance Policy      (d) Sound Legal System
- (4) In which of the below instruments, there is no default risk ?  
(a) Treasury Bills      (b) Commercial Paper  
(c) Certificate of Deposit      (d) Commercial Bills
- (5) The minimum maturity period in case of Certificate of deposit is less than \_\_\_\_\_ days.  
(a) 91      (b) 60  
(c) 15      (d) 7
- (6) The minimum maturity period in the Term Money Market is \_\_\_\_\_.  
(a) 15 days      (b) 30 days  
(c) 1 year      (d) 3 months
- (7) SEBI was given statutory powers in \_\_\_\_\_.  
(a) August 1992      (b) December 1992  
(c) January 1992      (d) March 1992
- (8) A Red Herring Prospectus does not have details about \_\_\_\_\_.  
(a) price of the shares      (b) total issue size  
(c) name of merchant banker      (d) date of opening of the issue

